

ક્રમાંક:આરબી-૭૨/ગુજ.સામયિક/સા.કા/૧૦/૨૦૨૦
પોલીસ અધિક્ષકની કચેરી,
રાજકોટ ગ્રામ્ય જીલ્લા,
રાજકોટ. તા.૧૧/૧૧/૨૦૨૦.

વિષય: ગુજરાત સામયિકમાં પોલીસ વિભાગને લગતા લેખો પ્રસિધ્ધ
કરવા બાબત
માહે- ઓક્ટોબર/૨૦૨૦
આધાર:આપશ્રીની કચેરીના પત્રાંક:સી.બી-૪/ગુજ.મેગે./૧૫/૩૧,
તા.૨૫/૦૩/૨૦૧૫ અન્વયે.

જય ભારત સાથે ઉપરોક્ત વિષય તથા આધાર પરત્વે જણાવવાનું કે, માહે-
ઓક્ટોબર/૨૦૨૦ ના માસ દરમિયાન વણ શોધાયેલ ગુના શોધી કાઢવાની પોલીસે કરેલ
સારી કામગીરીની વિગત તૈયાર કરી આ સહ પેટામાં સામેલ રાખી સાદર કરેલ છે યોગ્ય
થવા વિનંતી છે.

બિડાણ :- ઉપર મુજબ.

(ટી.એસ.રીઝવી)
રીડર પો.સબ ઇન્સ.
રીડર શાખા,
રાજકોટ ગ્રામ્ય જીલ્લા રાજકોટ

પ્રતિ,
પો.સબ.ઇન્સ.શ્રી
કોમ્પ્યુટર શાખા આ કચેરી

રાજકોટ રૂરલ જિલ્લા :- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ઓક્ટોબર/૨૦૨૦

લૂંટ

- (૧) તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ સવારના દસ વાગ્યાના સમયે ફરીયાદી ચીમનભાઈ કાળાભાઈ વેકરીયા રહે. ધોરાજી વાળા જેતપુરમાં સોનાના દાગીના ખીરીદી કરી કમીશનથી વેપાર કરતા હોય અને પોતે થેલામાં આશરે વજન ૭૧૦ ગ્રામ સોનાના દાગીના કી.રૂ. ૨૮,૪૦,૦૦૦/ તથા રોકડ રૂપિયા ૨૦૦૦૦૦/ એક થેલામાં ભરીને પગે ચાલીને જેતપુરના નાનાચોકથી મતવા શેરી તરફ જતા હોય તે દરમિયાન બે અજાણ્યા ઇસમો મોટર સાયકલ પર આવી. ફીરયાદીની આંખમાં મરચાનો પાઉડર છાંટી ફરીયાદીના પગમાં છરીથી ઇજા કરી ફરીયાદીના હાથમાં રહેલ થેલો લૂંટી નાશી ગયેલની ફરીયાદ જેતપુર સીટી એ.ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૦૧૬૬૫/૨૦ IPC. ૩૯૪,૧૧૪ તથા GP Act કલમ ૧૩૫ મુજબ થી બે અજાણ્યો વિરૂધ્ધ નોંધાયેલ જેથી તુર્ત જ એલ.સી.બી., એસ.ઓ.જી.ની બે અલગ-અલગ ટીમો બનાવી તેમજ જેતપુરના “આઇ-વે પ્રોજેક્ટ” અંતર્ગત સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી આરોપીઓની સાચી ઓળખ મેળવી તેઓને ઝડપી પાડવા માટે અમદાવાદ, જામનગર, વડોદરા, ચોટીલા તથા રાજકોટ શહેરમાં મોકલી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની ખાગની રાહે બાતમી આધારે આ ગુનાના સંડોવાયેલ તમામ આરોપીઓ રાજકોટ શહેર કોઠારીયા સોલ્વટ ઢોલરા રોડ બરકતીનગર મેઇન રોડ ઉપરથી આરોપી અકબર રીંગડીયાના રહેણાક મકાને લૂંટના સોનાના દાગીના તથા રોકડ રકમની ભાગ બટાઇ માટે ભેગા થવાના હોય તેવી સચોટ બાતમી મળતા તે જગ્યાએ વોચ રાખી (૧) સાકીર સ/ઓ મુસાભાઇ ખેડારા રહે. જેતપુર ગોંડલ દરવાજા ટાવર (૨) સમીર ઉર્ફે ભડાકો સ/ઓ હનીફભાઇ વડાભાઇ કુરેશી રહે.રાજકોટ કોઠારીયા સોલ્વટ મસ્જીદ પાસે તા.જી.રાજકોટ (૩) તુફેલ ઉર્ફે બબો સ/ઓ મુસાભાઇ ખેડારા રાજકોટ કોઠારીયા સોલ્વટ મહમદીબાગ મસ્જીદની બાજુમાં તા.જી.રાજકોટ (૪) અકબરભાઇ જુસબભાઇ રીંગડીયા જાતે ધાંચી પીંજાર રહે.રાજકોટ કોઠારીયા સોલ્વટ બરકતીનગર તા.જી.રાજકોટ મુળ પારડી તા.લોધીકા જી.રાજકોટ વાળા ચારેય આરોપીઓને લૂંટમાં ગયેલ તમામ અસલ મુદામાલ સોનાના દાગીના વજન આશરે ૫.૭૭.૮૦/ ગ્રામ કી.રૂ. ૨૮,૪૦,૦૦૦/- રોકડા રૂપિયા ૧,૪૩,૦૦૦/- મોબાઇલ ફોન નંગ ૫ કી.રૂ. ૧૨૦૦૦/- એક મોટી છરી કી.રૂ. ૫૦/- મોટર સાયકલ -૧ રૂ. ૧૫૦૦૦/- એમ મળી કુલ મુદામાલ રૂ. ૩૦,૧૦,૦૫૦/-નો મુદામાલ સાથે ઝડપી પાડી વણશોધાયેલ લૂંટના ગુન્હાને શોધી ચકચારી લૂંટના બનાવનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

એન.ડી.પી.એસ. કેસ

- (૨) તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમીરાહે હકીકત મળેલ કે, રાજીવકુમારસિંહ કૈલાશસિંહ ભુમિહાર જાતે ઠાકુર રહે.પરીન ફર્નીચરનાની ઓરડી નં.૧૬ માં બીલીયાળા ગામના પાટીયા પાસે વાળો પોતાની કબ્જા ભોગવટાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ (માદક પદાર્થ) નો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા રાજીવકુમારસિંહ કૈલાશસિંહ ભુમિહાર જાતે ઠાકુર ઉ.વ.-૩૮ ધંધો-મજૂરી રહે મુળ પુર્વી ગુગુલડીહ ગામ (કેવલ) ગિઘૌર પો.સ્ટે. ગુગુલડીહ જમુઇ બિહાર હાલે પરીન ફર્નીચર ના મેન્યુફેક્ચરીંગ યુનિટ ની ઓરડી નં-૧૬ માં બીલીયાળા ગામ ના પાટીયા પાસે તા.ગોંડલ જી.રાજકોટ વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં ગેર કાયદેસર રીતે વનસ્પતિ જન્ય ગાંજા ના ઘટકો વાળો માદક પદાર્થ નો જથ્થો કુલ વજન ૧ કિલો ૯૫૦ ગ્રામ કિ.રૂ. ૧૯,૫૦૦/- નો રાખી વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦/- તથા કીટબેગ નંગ- ૧ કિ.રૂ.૨,૦૦/- મળી કુલ રૂ.૨૦,૨૦૦/- ગણી કબ્જે કરેલ તથા આરોપીને હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ ગોંડલ તાલુકા પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.૯૩૫/૨૦૨૦ એન.ડી.પી.એસ એક્ટ ૬.૮(સી),૨૦-બી(૨-બી) મુજબ ગુન્હો રજી. કરાવેલ.